

સુમુલ તથા અમુલ તથા સાગર જેવી વિશ્વપ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીઓના ધી તથા FORTUNE રીફાઇન્ડ ઓઇલ કંપનીના તથા બીજા અલગ અલગ ખાદ્ય તેલ ઉત્પાદન કરતી કંપનીઓના નામથી ભેળસેળ કરનાર ટોળકીને છટકુ ગોઠવી રેઇડ કરતા ત્રણ ઇસમોને ઉપરોક્ત બ્રાન્ડેડ કંપનીઓના લેબલીંગવાળા ધીના પેકેટોમાં ભેળસેળવાળા ડુપ્લીકેટ ધીનો જથ્થો કુલ આશરે ૩૫૮.૫ કિલો કિ.રૂ.૧,૭૩,૭૨૦/- તથા અન્ય ભેળસેળ કરવાની સાધન સામગ્રીઓ મળી કુલ કિ.રૂ.૩,૨૦,૪૬૨/- ની મત્તાનો મુદ્દામાલ ઝડપી પાડતી "સુરત શહેર પી.સી.બી શાખા "

સુરત શહેર વિસ્તારમાં ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરનાર અને કાળાબજારી કરનાર ઇસમોની પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સારૂ અને આ સંદર્ભે યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવા સારૂ આજરોજ તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ પી.સી.બી. શાખાના રટાફના પોલીસ માણસો તથા FORTUNE રીફાઇન્ડરી ઓઇલ કંપનીના અધિકૃત કર્મચારીઓને સાથે રાખી આ સંદર્ભે તેમની પાસેથી ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરનાર વ્યક્તિઓની બાબતે યોગ્ય દિશાએ તપાસ શરૂ કરવામાં આવતા સુરત રાઈર રોડ, પાલનપુર પાટીયા, મશાલ ચોકની પાસે આવેલ ગુ.હા.બોર્ડમાં મકાન નં.૫૫/૫૧૪ માંથી આરોપીઓ (૧) જનકભાઈ વિનોદભાઈ ભલયાવાલા ઉ.વ.૪૫ રહે. બીલ્ડીંગ નં.૬૮, રૂમ નં.૫૭૧, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાલનપુર પાટીયા, રાઈર, સુરત તથા (૨) સંલવભાઈ વામનરાવ નાદકરણી ઉ.વ. ૬૩ રહે. સી/૧૧૨, બાલાલ કૃપા સોસાયટી, પાલનપુર જકાતનાકા, અડાજણ, સુરત નાઓની પ્રિમાઇરીસમાં રેઇડ કરતા સદર ગોડાઉનમાંથી સુમુલ કંપની, અમુલ કંપની, સાગર કંપનીના ભેળસેળવાળુ ધી આશરે ૩૫૮.૫ લીટરની મત્તાનો ડુપ્લીકેટ ધીના શીલ કરેલા પેકેટો મળી આવેલ તેમજ મજકુર ઇસમો રાઈર પાલનપુર પાટીયા, મશાલ ચોક પાસે આવેલ સીમાનગર સોસાયટી દુકાન નં.૮ માં આવેલ દિવા ટ્રેડર્સ ખાતે સપ્લાય કરતો હોવાથી હકિકત જણાવતા સદર બીજા જગ્યાએ રેઇડ કરતા ત્યાં "દિવા ટ્રેડર્સ"નામની દુકાનમાંથી સહ આરોપી (૩) જયેન્દ્રભાઈ ઉર્ફે જયભાઈ પ્રભુભાઈ લાખાણી ઉ.વ.૩૦ રહે.ફ્લેટ નં.૯/૫૦૧, શ્રીપત રેસીડેન્સી એલ.પી.સવાણી કેનાલ રોડ અડાજણ, સુરત મુળ રહે. ઘર નં.૧૨, માડતીધામ સોસાયટી તા.કોડીનાર જી.જી.નાગઢ નાઓ પાસેથી ડુપ્લીકેટ ધીનો બીજે જથ્થો મળી આવતા મજકુર ત્રણેય ઇસમોની પુછપરછ તેમજ તપાસમાં તેઓ ત્રણેય જણા સોરી છુપીથી ગ્રાહકની પાસેથી ઓછી પડતરે વધુ નહો મેળવવાની કાળાબજારી કરી સુમુલ કંપની તથા અમુલ કંપની તથા સાગર કંપની જેવી વિશ્વવિખ્યાત બ્રાન્ડેડ કંપનીઓના ધી તથા FORTUNE રીફાઇન્ડ ઓઇલ કંપનીના તથા બીજા બ્રાન્ડેડ રીફાઇન્ડ તેલ કંપનીઓના લેબલો, માર્કો અને સીક્કા મારી ભેળસેળ વાળુ ધી, તેલ વિગેરે ચીજ વસ્તુઓ ભેળસેળ કરી એકબીજાની મદદગારી કરી લોકોના સ્વાસ્થ્યને બેખમમાં મુકે તેવી રીતે કાળા બજારી કરતા મળી આવતા ઉપરોક્ત ત્રણેય ઇસમોની પાસેથી ભેળસેળવાળુ અલગ અલગ કંપની બ્રાંડના ધી ના પેકેટો મળી આશરે ૩૫૮.૫ લીટર ધી તથા અન્ય સાધન સામગ્રીઓ મળી કુલ કિ.રૂ. ૩,૨૦,૪૬૨/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનિય કામગીરી કરેલ છે.